

ભારતીય કાયદાકીય પ્રશ્નપત્ર-1

1. ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિષે છે ?
(A) પ્રકરણ - 3 (B) પ્રકરણ - 4 (C) પ્રકરણ - 5 (D) પ્રકરણ - 6
2. ભારતીય પુરાવા અધિનિયમ, 1872 કોને લાગુ પડે છે ?
(A) ન્યાયિક કોર્ટ સમક્ષ કાર્યવાહીને
(B) ટ્રિબ્યુનલ સમક્ષ કાર્યવાહીને
(C) આર્બિટ્રેટર સમક્ષ કાર્યવાહીને
(D) આપેલા તમામને
3. ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિષે છે ?
(A) પ્રકરણ - 7 (B) પ્રકરણ - 8 (C) પ્રકરણ - 9 (D) પ્રકરણ - 6
4. ભારતીય પુરાવા અધિનિયમ, 1872ની કલમ ૬૬ મુજબ નીચેનામાંથી કોણ નિષ્ણાંતની પરિભાષામાં આવતા નથી ?
(A) ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ (B) હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ (C) પોલીસ સબ-ઈન્સ્પેક્ટર (D) ફોરેન્સિક એક્સપર્ટ
5. ભારતીય પુરાવા ધારા મુજબ નીચેનામાંથી કોણે 'દસ્તાવેજ' તરીકે ગણવામાં આવે છે ?
(A) બેન્ક ખાતાના ચોપડાઓ
(B) બે વ્યક્તિઓ વચ્ચે પત્રોની આપ લે
(C) ઇલેક્ટ્રોનિક રેકોર્ડ
(D) આપેલા તમામ
6. સામાન્ય રીતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(A) પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કોર્ટમાં અસ્વીકાર્ય છે.
(B) પ્રલોભન અથવા ધમકીથી કરેલી કબૂલાત કોર્ટમાં અસ્વીકાર્ય છે.
(C) નાયબ પોલીસ અધિક્ષ અને તેની ઉપરના અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કોર્ટમાં સ્વીકાર્ય છે.
(D) આપેલમાંથી કોઈપણ નહીં
7. 'હકીકત' અંગે કયું વાક્યાં સાચું છે ?
1. ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ.
2. કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ
(A) 1 અને 2 કોઈ સાચા નથી (B) માત્ર 2 સાચું છે.
(C) માત્ર 1 સાચું છે. (D) 1 અને 2 બંને સાચા છે.
8. સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?
1. પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સરતપાસમાં ન પૂછી શકાય.
2. ફેરતપાસમાં વ્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય.
(A) 1 અને 2 કોઈ સાચા નથી (B) માત્ર 2 સાચું છે.
(C) માત્ર 1 સાચું છે. (D) 1 અને 2 બંને સાચા છે.

9. ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમ ડાઇંગ ડિકલેરેશન બાબતે છે ?

- (A) 12 (B) 22 (C) 32 (D) 42

10. નીચેનામાંથી કયા પુરાવા ન્યાયિક કોર્ટમાં સ્વીકાર્ય નથી ?

- (A) મૌખિક પુરાવા (B) ફોરેન્સિક પુરાવા (C) દસ્તાવેજી પુરાવા (D) પોલીસ અધિકારી સમક્ષ આપેલ નિવેદન

11. સાક્ષીઓની તપાસવાનો સામાન્યપણે કયો ક્રમ સાચો છે ?

- (A) ફેરતપાસ, ઊલટતપાસ, સ્થળતપાસ (B) સ્થળતપાસ, ફેરતપાસ, ઊલટતપાસ,
(C) સ્થળતપાસ, ઊલટતપાસ, ફેરતપાસ (D) ઊલટતપાસ, ફેરતપાસ, સ્થળતપાસ

12. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?

1. લખાણ એ દસ્તાવેજ છે.
2. મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે.

- (A) 1 અને 2 કોઈ સાચા નથી (B) માત્ર 2 સાચું છે.
(C) માત્ર 1 સાચું છે. (D) 1 અને 2 બંને સાચા છે.

13. ભારતીય એવિડન્સ એક્ટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતું નથી ?

- (A) ઇશારાથી કરેલું નિવેદન (B) નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
(C) નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય (D) ઉપરના તમામ હેતુઓ

14. ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમમાં ' સાંભળેલ પુરાવા' અંગેની જોગવાઈ છે ?

- (A) 55 (B) 58 (C) 57 (D) 60

15. ભારતીય એવિડન્સ એક્ટના કાયદામાં ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓમાં કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી ?

- (A) 1999 (B) 2000 (C) 2001 (D) 2002

16. કોઈ વ્યક્તિના કબજામાંથી ચોરીનો માલ મળી આવે તો ન્યાયાલય કેવા અનુમાન કરી શકે છે ?

- (A) તે વ્યક્તિ ચોર છે. (B) ચોરીનો માલ ખરીદનાર છે. (C) તે ચોરીના ગુનાનો સાથી છે. (D) આપેલ તમામ

17. ભારતીય એવિડન્સ એક્ટના કાયદાની કલમ 113 (B)માં કયા વર્ષમાં ' દહેજ હત્યા ધૂષ્ટતા' તરીકે સામેલ કરવામાં આવી?

- (A) 1962 (B) 1983 (C) 1981 (D) 1986

18. ભારતીય એવિડન્સ એક્ટમાં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા કયારે માન્ય રખાતી નથી ?

- (A) અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલી જુબાની
(B) પ્રશ્નોનાં ઉત્તર બુદ્ધિની કસોટી પર ન હોય
(C) અંધ બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની
(D) આપેલ કોઈ પણ પરિસ્થિતિમાં

19. કયા પ્રકારના પુરાવામાં ઊલટતપાસ થઈ શકતી નથી ?

- (A) ઇલેક્ટ્રોનિક્સ પુરાવા (B) પ્રત્યક્ષ પુરાવા (C) ફોટોગ્રાફી (D) કાનથી સાંભળેલા પુરાવા

20. નીચેનામાંથી કોણ ભારતીય એવિડન્સ એક્ટના કાઠા મુજબ નિષ્ણાંત તરીકે સેવા આપી શકે ?

(A) ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ (B)હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ (C) અસ્ત્રવિદ્યા એક્સપર્ટ (D)ઉપરના તમામ

21. આરોપીએ પોલીસ કસ્ટડીમાં કરેલી કબૂલાત ક્યારે માન્ય ગણાય છે ?

(A) પબ્લિક પ્રોસિક્યુટર સમક્ષ કબૂલાત કરી હોવી જોઈએ.

(B)મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત કરી હોવી જોઈએ.

(C) પોલીસ અધિકારી સમક્ષ કબૂલાત કરી હોવી જોઈએ.

(D) આરોપીની કબૂલાત રિસેસ સિવાયના સમયે હોવી જોઈએ.

22. નીચેનામાંથી શું શું હકીકત સત્ય છે ?

i. દસ્તાવેજમાં સંદિગ્ધતા એક જ પ્રકારની હોય છે.

ii. દસ્તાવેજમાં સંદિગ્ધતા બે પ્રકારની હોય છે.

iii દસ્તાવેજમાં સંદિગ્ધતા દ્રશ્ય કે ગુપ્ત હોય શકે

iv. દસ્તાવેજમાં સંદિગ્ધતા દ્રશ્ય હોય ત્યારે તે દૂર કરવા પુરાવા આપી શકાય.

(A) i,iii,iv

(B)ii,iii

(C) i,ii,iii,iv

(D) આપેલ તમામ

23. નીચેનામાંથી શું સત્ય હકીકત છે ?

(A) દસ્તાવેજના કોઈ પ્રકારો હોતા નથી.

(B)દસ્તાવેજના દસ પ્રકારો છે.

(C) તમામ દસ્તાવેજો ખાનગી દસ્તાવેજો હોય છે.

(D) દસ્તાવેજ ખાનગી અથવા જાહેર કોઈ શકે છે.

24. 'કબૂલાત' ક્યારે સ્વીકાર્ય હોય છે ?

(A) મેજિસ્ટ્રેટની હાજરીમાં હોય.

(B)પોલીસ કસ્ટડીમાં મેજિસ્ટ્રેટને કરેલ હોય

(C)પોલીસ ધમકીની અસર દૂર થયા પછી પોલીસને કરેલ કબૂલાત (D)આપેલ તમામ

25.ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમ હેઠળ થયેલ કબૂલાત સંદર્ભે કેટલોક ભાગ પુરાવા આધારિત સાબિત કરી શકાશે ?

(A) 24

(B) 25

(C) 26

(D)27

26. નીચેનામાંથી શું શું હકીકત સત્ય છે ?

i. અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરાતા દસ્તાવેજો દસ્તાવેજ પુરાવા છે.

ii. સાક્ષીઓનું નિવેદન મૌખિક પુરાવો છે.

iii દસ્તાવેજ પુરાવા સાંયોગિક પુરાવા છે.

iv. દસ્તાવેજ પુરાવો મૌખિક પુરાવા કરતાં વધારે સારો છે.

(A) i,ii,iv

(B)ii,iii

(C) i,ii,iii

(D) આપેલ તમામ

27. એવિડન્સ એક્ટની કલમ 45ના પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?

i. વિદેશી કાયદો

ii. કલા વિજ્ઞાન

iii રાજનીતિ

iv. હસ્તાંક્ષર કે આંગાની છાપ

(A) i,ii,iv

(B)ii,iii

(C) i,ii,iii

(D) આપેલ તમામ

28. એવિડન્સ એક્ટ પ્રમાણે હસ્તાંક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ કઈ રીત છે ?

i. હસ્તાંક્ષરથી પરિચિત વ્યક્તિના પુરાવાથી

ii. નિષ્ણાંત પુરાવાથી

iii જે તે વ્યક્તિને દસ્તાવેજ લખતા કે સહી કરતાં જોયેલ હોય તેના પુરાવાથી

iv. લખાણ કે સહી કરનાર વ્યક્તિની સ્વીકૃતિથી

(A) i,ii,iv

(B)ii,iii

(C) i,ii,iii

(D) આપેલ તમામ

29. એવિડન્સ એક્ટ 1872 અનુસાર કોણ કોણ વ્યક્તિ સાક્ષી ન બની શકે ?

i. મૂંગી વ્યક્તિ

ii. સગીર વ્યક્તિ

iii બુદ્ધિગમ્ય જવાબો આપી શકવાને અસમર્થ વ્યક્તિ

iv. વૃદ્ધ વ્યક્તિ જે બુદ્ધિગમ્ય જવાબો ન આપી શકે.

(A) i,ii,iv

(B)iii, iv

(C) i,ii,iii

(D) આપેલ તમામ

30. નિમ્નલિખિતમાંથી શું સાચું છે ?

i. આરોપી વ્યક્તિ સાક્ષી તરીકે લાયક ગણાશે.

ii. તેની પોતાની વિનંતી વિના તેને સાક્ષી તરીકે બોલાવી શકાશે નહીં.

iii તે જુબાની ન આપે તો, તે બાબતમાં ફરિયાદ પણ તરફથી કોઈ ટીકા કરી શકશે નહીં.

iv. ઉપરોક્ત તમામ વિધાનો સત્ય છે.

(A) i,ii,iv

(B)ii,iii

(C) i,ii,iii

(D) આપેલ તમામ

31. પુરાતન દસ્તાવેજ કેટલા વર્ષ જૂનાં હોય છે ?

(A) 15વર્ષ કે તેથી વધારે (B)20 વર્ષ કે તેથી વધારે (C) 25 વર્ષ કે તેથી વધારે (D) 30 વર્ષ કે તેથી વધારે

32. નિષ્ણાંતના અભિપ્રાય એવિડેન્સ એક્ટની કઈ કલમ હેઠળ માન્ય છે ?

(A) ક,9

(B)ક,45

(C) ક,35

(D) ક,27

33. નીચેનામાંથી શું શું ગૌણ પુરાવા છે ?

i. પ્રમાણિત નકલો

ii. મૂળ નકલમાંથી બનાવાયેલ નકલો

iii યાંત્રિક પ્રક્રિયાથી મૂળ નકલમાંથી બનાવાયેલ નકલ

iv. મૂળ નકલ સાથે સરખાવેલ નકલ

(A) i,ii,iv

(B)ii,iii

(C) i,ii,iii

(D) આપેલ તમામ

34. ત્રણ માણસો ઘરમાં ઘૂસીને ધમકી આપીને ઝવેરાત લઈ જાય તે તેમણે IPC-1860 મુજબ કયો ગુનો કહેવાય ?

(A) ધાડ

(B)લૂંટ

(C)બળજબરીથી કઢાવવું (D) ધાડ અને લૂંટ બંને

35. IPC-1860માં કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે ?
 (A) પ્રકરણ - 7/એ (B) પ્રકરણ - 8/એ (C) પ્રકરણ - 9/એ (D) પ્રકરણ - 11/એ
36. IPC-1860ની છેલ્લી કલમ શેના વિશે છે ?
 (A) ગુના કરવાની કોશિશ (B) કાવતરૂ (C) રાજ્ય વિરુદ્ધના ગુના (D) બળાત્કારના ગુના
37. IPC-1860 બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
 (A) પ્રકરણ- 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે.
 (B) પ્રકરણ- 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે.
 (C) પ્રકરણ- 17 મિલકત વિરુદ્ધના ગુનાઓની છે.
 (D) પ્રકરણ- 18 શરીર સંબંધી ગુનાઓનું છે.
38. કેટલી વયથી ઓછી મહિલાની મરજીથી પુરૂષે મહિલા સાથે કરેલી જાતિય સંભોગ, બળાત્કારનો કેસ ગણવામાં આવશે. ?
 (A) 15 વર્ષ (B) 16 વર્ષ (C) 18 વર્ષ (D) એક પણ નહીં
39. મહેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે તેને IPC-1860ની કઈ કલમ મુજબ ગુનો બને છે ?
 (A) કલમ- 259 (B) કલમ- 314 (C) કલમ- 379 (D) કલમ- 420
40. નીચેનામાંથી કયા પ્રસંગોમાં ગૌણ પુરાવો રજૂ કરી શકાય ?
 i. જ્યારે મૂળ દસ્તાવેજ એવી વ્યક્તિઓના કબજામાં હોય કે જેની સામે દસ્તાવેજ પુરવાર કરવાનો હોય.
 ii. જ્યારે મૂળ દસ્તાવેજ જાહેર દસ્તાવેજ હોય.
 iii. જ્યારે પક્ષકાર પોતાની બેદરકારીના કારણે મૂળ દસ્તાવેજ રજૂ ન કરી શકે.
 iv. જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયેલ હોય.
 (A) i,ii,iv (B) ii,iii (C) i,ii,iii (D) આપેલ તમામ
41. મહિલાને પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે IPC-1860ની કઈ કલમ મુજબ ગુનો દાખલ થશે ?
 (A) કલમ- 298/એ (B) કલમ- 398/એ (C) કલમ- 498/એ (D) કલમ- 397/એ
42. ભારતીય દંડસંહિતા 1860ની કલમ-18 મુજબ ' ભારત ' એટલે
 (A) ભારતનું ક્ષેત્ર જેમાં બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સામેલ છે.
 (B) જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાયનું ભારતનું ક્ષેત્ર
 (C) આંદોમાન નિકોબાએ ટાપુઓ અને લક્ષદ્વીપ સિવાયનું ભારતનું ક્ષેત્ર
 (D) આપેલામાંથી એક પણ નહીં
43. નીચેનામાંથી કઈ મહાવ્યથા નથી ?
 (A) કોઈપણ આંખની દ્રષ્ટિનું કાયમી નુકસાન
 (B) કોઈપણ કાનના શ્રવણનું કાયમી નુકસાન
 (C) માથું અથવા મુખનું કાયમી વિરૂપીકરણ
 (D) કોઈપણ ઇજા જેને 10થી વધારે ટાંકા આવ્યા હોય
44. IPC-1860 મુજબ ત્રાસની વ્યાખ્યા કઈ આપવામાં આવી છે ?
 (A) ફક્ત માનસિક ત્રાસ

- (B) ફક્ત શારીરિક ત્રાસ
 (C) પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા અપાતો ત્રાસ
 (D) પરિણીત પુરૂષને પત્ની દ્વારા અપાતો ત્રાસ

45. ભારતીય ફોજદારી ધારો એટલે શું ?

- (A) ઇન્ડિયન પીનલ કોડ (B) ઇન્ડિયન પ્રોસિજર કોડ (C) ઇન્ડિયન પોલીસ કોડ (D) ક્રિમિનલ પ્રોસિજર કોડ

46. બેદરકારીથી વાહન ચલાવવા બદલ ભારતીય દંડસંહિતાની કઈ કલમ મુજબ ગુનો બને છે ?

- (A) કલમ- 179 (B) કલમ- 279 (C) કલમ- 379 (D) કલમ- 479

47. ભારતીય દંડસંહિતા 1860માં કઈ સજાની જોગવાઈ નથી ?

- (A) મોતની સજા (B) રોકડ દંડ (C) આજીવન કેદ (D) સામાજિક સેવા

48. સ્વ બચાવનો હક્ક (રાઉટ ટુ પ્રાઈવેટ ડિફેન્સ) કઈ કલમમાં સમાવેશ કરવામાં આવ્યો છે ?

- (A) કલમ-94 (B) કલમ-95 (C) કલમ-96 (D) કલમ-97

49. ભારતીય દંડસંહિતા 1860માં કુલ કેટલા પ્રકારનો આપેલા છે ?

- (A) 22 (B) 23 (C) 25 (D) 30

50. IPC-1860ના કયા પ્રકરણમાં પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા અપાતો ત્રાસ વિરુદ્ધ ગુનાનું છે ?

- (A) પ્રકરણ -16 (B) પ્રકરણ -17 (C) પ્રકરણ -19/A (D) પ્રકરણ -18

51. IPC-1860ની કઈ કલમમાં અકસ્માત અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

- (A) કલમ-90 (B) કલમ-70 (C) કલમ-80 (D) કલમ-97

52. IPC -1860 ની કઈ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજવવા બદલ ગુનેગાર બનતો નથી ?

- (A) કલમ-90 (B) કલમ-70 (C) કલમ-80 (D) કલમ-77

53. IPC-1860ના કયા પ્રકરણમાં નોકરી કરારનો ગુનાહિત ભંગ બદલ સજાની જોગવાઈ ?

- (A) પ્રકરણ -16 (B) પ્રકરણ -17 (C) પ્રકરણ -19 (D) પ્રકરણ -18

54. IPC 1860નો ધારો પસાર કરનાર ગવર્નર કોન હતો ?

- (A) લોર્ડ કેનિંગ (B) લોર્ડ મેકોલે (C) લોર્ડ વેલેસ્લી (D) લોર્ડ રિપન

55. IPC-1860ની કઈ કલમમાં 20 વર્ષથી ઓછી વયની વ્યક્તિને અશ્લીલ સાહિત્ય વેચવું કઈ કલમ હેઠળ ગુનો બને છે ?

- (A) કલમ-283 (B) કલમ-290 (C) કલમ-293 (D) કલમ-273

56. ભારતીય ફોજદારી ધારો 1860 ક્યારથી અમલમાં આવ્યો છે ?

- (A) 6 ઓક્ટોબર 1860 (B) 6 માર્ચ 1860 (C) 6 જાન્યુઆરી 1860 (D) 6 એપ્રિલ 1860

57. ભારતીય દંડસંહિતા 1860ની કલમ-21 મુજબ કોન જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે ?

- (A) મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (B) પોલીસ સબ ઇન્સ્પેક્ટર (C) મ્યુનિસિપલ કમિશનર (D) આપેલ તમામ

58. IPC 1860નો ધારાની કઈ કલમમાં બખેડાની વ્યાખ્યા આપવામાં આવી છે ?

- (A) કલમ-155 (B) કલમ-157 (C) કલમ-159 (D) કલમ-169

59. IPC 1860નો ધારાની કઈ કલમમાં ખોટા પુરાવા રજૂ કરવા બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ?
 (A) કલમ-193 (B)કલમ-183 (C) કલમ-190 (D)કલમ-199
60. આતંકવાદી અને વિદ્યાર્થક પ્રવૃત્તિક પ્રતિરોધ ધારો (TADA) ક્યારે રદ કરવામાં આવ્યો હતો ?
 (A) 1980 (B)1985 (C) 1990 (D)1995
61. IPC-1860ના કયા પ્રકરણમાં ભારતીય નૌકાદળ, ભૂમિદળ અને હવાઈદળ સંબંધિત ગુનાને લગતું છે ?
 (A) પ્રકરણ - 7 (B)પ્રકરણ - 8 (C) પ્રકરણ - 9 (D) પ્રકરણ - 10
62. IPC 1860નો ધારાની કઈ કલમમાં પત્ની અથવા પતિની હયાતીમાં બીજું લગ્ન કરવા બદલ સજાની જોગવાઈ છે ?
 (A) કલમ-493 (B)કલમ-494 (C) કલમ-490 (D)કલમ- 420
63. IPC 1860નો ધારાની કઈ કલમમાંકોઈની ધાર્મિક લાગણી દુભાવવાના ઇરાદાથી કોઈ શબ્દો ઉચ્ચારવા કે ચેષ્ટા કરવા બદલ સજાની જોગવાઈ છે ?
 (A) કલમ-198 (B)કલમ - 298 (C) કલમ- 398 (D)કલમ- 498
64. IPC 1860નો ધારાની કઈ કલમમાં બનાવટી સરકારી સ્ટેમ્પ પેપરનું વેચાણ કરવુંએ કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
 (A) કલમ-158 (B)કલમ - 358 (C) કલમ- 258 (D)કલમ- 458
65. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ક્યારે લાગુ કરવામાં આવ્યો ?
 (A)1960 (B)1985 (C) 1988 (D) 1990
66. ફોજદારી કાર્યરીત અધિનિયમ ક્યારે લાગુ કરવામાં આવ્યો ?
 (A)1975 (B)1970 (C) 1980 (D) 1973
67. ભારતીય પુરાવા અધિનિયમ ક્યારે લાગુ કરવામાં આવ્યો ?
 (A)1972 (B)1970 (C) 1980 (D) 1973
68. ગુજરાત નશાબંધી અધિનિયમ ક્યારે લાગુ કરવામાં આવ્યો ?
 (A)1975 (B)1949 (C) 1950 (D) 1973
69. ગુજરાત પોલીસ અધિનિયમ ક્યારે લાગુ કરવામાં આવ્યો ?
 (A)1952 (B)1950 (C) 1951 (D) 1973
70. સર્વોચ્ચ અદાલતના આદેશને ધ્યાનમાં લઈ ગુજરાતમાં બોમ્બે પોલીસ એક્ટ-1951માં ક્યારે સુધારો કરવામાં આવ્યો ?
 (A) 2005 (B) 2006 (C)2007 (D) 2008
71. ભારતીય દંડસંહિતામાં એક પ્રકરણમાં માત્ર એક જ કલમ આપેલ છે તે કઈ કલમ છે ?
 (A) કલમ- 420 (B)કલમ -498/A (C) કલમ - 478 (D)કલમ- 473/A
72. IPC 1860માં પ્રકરણ -4 ના વિષે છે ?
 (A) દુષ્પરણ (B)ગુનાહિત કાવતરૂ (C) સામાન્ય અપવાદો (D) રાજ્ય વિરુદ્ધના ગુનાઓ
73. સામાન્ય રીતે કોઈ ફોજદારી કેસ માટે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિને રિમાન્ડ પર પોલીસ હીરાસતમાં અધિકતમ કેટલા દિવસ રાખી શકાય છે ?
 (A) 14 (B)15 (C) 16 (D) 17
74. IPC-1960મુજબ નીચે આપેલ વિધાનોમાં કયું સાચું છે?

(1)કલમ- 302માં ખૂનની સજાની જોગવાઈ

(2)કલમ-307માં ખૂનની કોશીષની સજાની જોગવાઈ

(3)કલમ- 379માં ચોરીની સજાની જોગવાઈ

(4) કલમ- 395માં ધાડની સજાની જોગવાઈ

(A) ફક્ત- 1

(B) 1 અને 2

(C) 1,2અને 3

(D)આપેલ તમામ

75. Cr.P.C (ક્રિમિનલ પ્રોસિજર કોડ)1973માં કઈ કલમ મુજબ FIR દાખલ થાય છે ?

(A) કલમ- 145

(B)કલમ -154

(C) કલમ- 164

(D)કલમ- 146

76. Cr.P.C (ક્રિમિનલ પ્રોસિજર કોડ)1973ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે ?

(A) કલમ- 45

(B)કલમ -41

(C) કલમ- 43

(D)કલમ- 46

77. Cr.P.Cની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ?

(A) કલમ- 45

(B)કલમ -41

(C) કલમ- 43

(D)કલમ- 46

78. પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે છે ?

(A) 12 કલાક

(B)24 કલાક

(C) 36 કલાક

(D) 36કલાક

79. ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ,1973ની જોગવાઈ મુજબ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાંથી કયો હક્ક મળતો નથી ?

(A)ધરપકડના કરણની માહિતી મેળવવાનો હક્ક

(B)જામીન મેળવવાનો હક્ક જો ગુનો જામીનપાત્રહોય તો

(C)પૂછપરછ દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક્ક

(D) તેના ઘરથી પોતાની પસંદગીનું ભોજન મેળવવાનો હક્ક

80. નીચેનામાંથી કયું કથન સાચું નથી ?

(A)એકવાર આરોપનામું ઘડયા બાદ કોઈપણ ફોજદારી કેસને તેની કાર્યવાહીમાંથી પાછો ખેંચી શકતો નથી.

(B)ફરિયાદી કોઈપણ ફોજદારી કેસને કોઈપણ સમયે પાછો ખેંચી શકે છે.

(C) કેસની તપાસ કરતાં પોલીસ અધિકારી કોઈપણ ફોજદારી ગુનાને પાછો ખેંચી શકે છે.

(D)આપેલ તમામ

81. સમન્સ કોના દ્વારા બજવવામાં આવે છે?

(A) પોલીસ અધિકારી દ્વારા

(B)કોર્ટના અધિકારી દ્વારા

(C)આપેલામાંથી કોઈપણ એક

(D)એકપણ નહીં

82. ફરિયાદની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ?

(A) રૂ. 100

(B)રૂ. 50

(C) રૂ. 10

(D) વિના મૂલ્યે

83. પોલીસની તપાસ પશ્ચાત ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ કેસને સંબંધિત કોર્ટમાં મોકલવામાં આવે છે ?

- (A) કલમ- 245 (B)કલમ -234 (C) કલમ- 173 (D)કલમ- 342
84. ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની અંતિમ કલમ કઈ છે ?
 (A) કલમ- 434 (B)કલમ -444 (C) કલમ-474 (D)કલમ- 484
85. ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની અંતિમ પ્રકરણ કયું છે ?
 (A) 37 (B) 35 (C) 33 (D)31
86. કોન્વિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ Cr.P.Cની કઈ કલમ હેઠળ વોરંટ વિના ધરપકડ કરી શકે છે ?
 (A)Cr.P.C કલમ- 151 (B)Cr.P.C કલમ- 145 (C) Cr.P.C કલમ- 141 (D) Cr.P.C કલમ- 155
87. Cr.P.C ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?
 (A)Cr.P.C કલમ- 151 (B)Cr.P.C કલમ- 145 (C) Cr.P.C કલમ- 141 (D) Cr.P.C કલમ- 165
88. ક્રિમિનલ પ્રોસિજર કોડ કલમ- 144 હેઠળના હુકમનો ઉદ્દેશ્ય શો છે ?
 (A)હુલ્લસ કે બખેડો અટકાવવાનો
 (B)જાહેર શાંતિમાં દાખલ અટકાવવાનો
 (C)માનવ-જિંદગી કે સલામતીનો ભય અટકાવવાનો
 (D)આપેલ તમામ
89. સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીને આધીન છે ?
 (A) રાષ્ટ્રપતિ (B)સુપ્રિમકોર્ટ (C)હાઇકોર્ટ (D) ગૃહ મંત્રાલય
90. નિગૃહણીય ગુનો એટલે શું ?
 (A)ગંભીર પ્રકારના ગુના
 (B)જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે
 (C) જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે
 (D)દિવાની પ્રકારના
91. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ-125 હેઠળ કોણે ભારણ પોશનનો દાવો માંગી શકે ?
 (A) પત્ની (B)માતાપિતા (C) બાળકો (D) આપેલ તમામ
92. પબ્લિક પ્રોસિક્યુટર માટેના નામોની પેનલ કોણ નક્કી કરે છે ?
 (A) હાઇકોર્ટના રજીસ્ટ્રાર (B)જિલ્લા કલેક્ટર (C) ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ (D) હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
93. અન્વેષણ અંગે કયું વિધાન ખોટું છે ?
 (A) અન્વેષણમા પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે.
 (B)અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે
 (C)અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે.
 (D) અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે.
94. કરફ્યુ કઈ કલમ હેઠળ લગાડવામાં આવે છે ?
 (A) આઈ.પી.સી. કલમ-144(B)Cr.P.C કલમ-144 (C)ગુજરાત પોલીસ એક્ટ કલમ-144 (D) આઈ.એ.સી.-144

95. Cr.P.C ની કઈ કલમ હેઠળ પુરાવો અપૂરતો હોય ત્યારે આરોપીને છોડી શકાય ?

(A) Cr.P.C કલમ- 161 (B) Cr.P.C કલમ- 166 (C) Cr.P.C કલમ- 169 (D) Cr.P.C કલમ- 165

96. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 ક્યારથી અમલમાં આવ્યો ?

(A) 1 જાન્યુઆરી 1973 (B) 1 ઓક્ટોબર 1973 (C) 1 એપ્રિલ 1973 (D) 1 જૂન 1973

97. Cr.P.Cમાં છેલ્લો સુધારો ક્યારે થયેલો છે ?

(A) 2000 (B) 2002 (C) 2006 (D) 2009

98. Cr.P.C ની કઈ કલમ હેઠળ બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી થાય છે ?

(A) Cr.P.C કલમ- 199 (B) Cr.P.C કલમ- 188 (C) Cr.P.C કલમ- 200 (D) Cr.P.C કલમ- 197

99. Cr.P.C ની કઈ કલમ હેઠળ ઝડપી વોરંટના હુકમ થાય છે ?

(A) Cr.P.C કલમ- 91 (B) Cr.P.C કલમ- 92 (C) Cr.P.C કલમ- 93 (D) Cr.P.C કલમ- 95

100. Cr.P.C ની કઈ કલમ હેઠળ જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવાની સંભાવના હોય ત્યારે પ્રક્રિયા થાય છે ?

(A) Cr.P.C કલમ- 151 (B) Cr.P.C કલમ- 146 (C) Cr.P.C કલમ- 144 (D) Cr.P.C કલમ- 145